



ભુવનેશ્વર મંદિર, જુનાભલાડાનો ઇતિહાસ



વિશ્વની પ્રાચીન સંસ્કૃતિમાંઓમાં ગ્રીક અને ભારતની સંસ્કૃતિનો સમાવેશ થાય છે.હિંદુ સંસ્કૃતિમાં શ્રુતિ અને સ્મૃતિમાં ભગવાનની અલૌકિક રચનાઓ અને કાર્યો દર્શાવવામાં આવેલ છે.૧૮ પુરાણો પૈકી શિવપુરાણમાં શિવનો મહાત્મ્ય વર્ણવવામાં આવ્યો છે .

વિક્રમ સંવત ૧૬૩૦માં ગામ વિરપુરના ફૂલચંદ શાહ તથા તેમના ધર્મપત્ની ઉજળીબાઈ જુના ભલાડા મુકામે ધી લેવા આવેલા ત્યારે આ ગામ ની ઉત્તરે આવેલા તળાવની પાળ પરથી ડોડી નામના વેલાની ઉઢણી બનાવી ધીનો ઘાડવો માથે લઈ વીરપુર મુકામે ગયેલા .આ ધીને શેઠે અન્ય પાત્રમા રેડી ઘાડવો પુનઃઉઢણી પર મૂકી દીધો .પરંતુ આ ઘાડવો ફરીથી ધી થી ભરાઈ ગયો.જેને શેઠે ફરીથી અન્ય પાત્રમા ભરી લીધું .આવું વારંવાર થવાથી શેઠે ખાલી ડબ્બા હતા તે પણ ભરી લીધા .રાત્રે જમી પરવારીને સુઈ ગયા .તો રાત્રે સપનામાં તેમને વેલો લીધેલી જગ્યા દેખાઈ અને શિવલિંગ પણ દેખાયું.

ફૂલચંદ શેઠ સવારે ભલાડા આવી વેલાવાળી જગ્યા સાફ-સુફ કરતાં મહાદેવનું શિવલિંગ દેખાયું. આ જગ્યા એ શેઠે “ ભુવનેશ્વર મહાદેવ મંદિર ” બંધાવ્યું .જેનો દરવાજો ઉગમણી દિશામાં રખાયો અને જેનું સંચાલન ગામના પગી ડગરજીભાઈ ને સોંપ્યું .ત્યારબાદ આ મંદિરની સેવા માટે ગામ સિધ્ધપુરથી તપોધન બ્રાહ્મણ જય શંકરભાઈ ને લાવેલા. જેમને શિવની પૂજા પેટે મંદિરની દક્ષિણ દિશામાં આવેલી જમીન ખેડવા માટે આપી .આ જમીનમાં આગળ જતા જય શંકરભાઈ એ કુવો ખોદાવ્યો .

આ મંદિરે દર જન્માષ્ટમી એ મેળો ભરાય છે ,જેમાં નજીકનું મહેરામણ વ્યાપક પ્રમાણમાં ઉમટી આવે છે .ભલાડા ગામ પંચમહાલ હાલ મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલું છે.જે તાલુકા મથકેથી ૨૦ કિ.મી.

દુર આવેલ છે . આ લેખ સંવત ૧૮૮૦માં સિદ્ધપુરના ગેલીદાસ બારોટના ચોપડે લખાયો હતો . જે સંવત ૨૦૫૭ના માગશર સુદ ૧૫ને સોમવારના દિને ભુવનેશ્વર મંદિર પર લખાયેલ છે.

વિક્રમભાઈ બી.ભોઈ

પ્રાથમિક શાળા

જુના ભલાડા

Copyright © 2012 – 2019 KCG. All Rights Reserved. | Powered By: Knowledge Consortium of Gujarat